

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૧૨/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૮૩/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૪ કેસ કરી, ૨૨ વ્યક્તિઓને ઝડપી, ૧૧૩ લીટર દેશી દારૂ, ૦૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૪ બીયરટીન અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૧૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૫,૪૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૮૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૮૫/૧૭

મણિનગર : રાકેશભાઈ હસમુખલાલ સોની (રહે,ગોપાલક ફ્લેટ, જગાભાઈ પાર્ક, રામબાગ, મણિનગર) એ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૮/૧૨/૧૭ રાતના ૮/૩૦ થી તા.૧૦/૧૨/૧૭ ના કલાક ૧૦/૪૫ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૦૯,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ટી.એન.મોરડીયા ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૨૪૮૬/૧૭

સરદારનગર : નિલમબેન મુકેશભાઈ જેઠાણી (રહે,સોરાબજી કમ્પાઉન્ડ સિંધી બજાર જુના વાડજ) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૨/૧૭ સાંજના ૭/૧૫ વાગ્યાના સુમારે "જી" વોર્ડ બસ સ્ટેન્ડ, મહાવીર કસરતશાળા પાસે રોડ ઉપરથી પોતે તથા સાહેદ કિંજલબેન પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૩૦ વર્ષના આશરના) નિલમબેન નાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા કિંજલબેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સર્વેલન્સ સ્કોર્ડ નાઓ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૪૮૭/૧૭

વસ્ત્રાપુર : નિવેત વિનોદન (ઉ.વ.૧૯)(રહે,જલદીપ બંડોઝ, વિભાગ-૨ વસંત વિહાર રોડ બોપલ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૨/૧૭ ના કલાક ૮/૦૦ થી ૧૦/૦૦ સુધીનાં સમયગાળા દરમ્યાન જી.એમ.ડી.સી, ગ્રાઉન્ડમા આલ્ફાવન મોલની પાછળ ગોકુલ આવાસની સામે રોડની બાજુમા આવેલ કોટની દિવાલ પાસે પાર્ક કરેલ પોતાની તથા તેમના મિત્રોની એકટીવાઓની ડેકીઓ ના લોક તોડી, અજાણી વ્યક્તિ અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૧૯,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૪,૦૦૦/- સાથેનુ પર્સ મળી કુલ રૂપિયા ૨૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી જેશીંગભાઈ હમીરભાઈ ચલાવે છે.

કારખાનાની સીડી ઉપરથી પડી જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૪૮૮/૧૭

શહેરકોટડા : કમલભાઈ રામવિલાસ ગૌતમ (ઉ.વ.૨૭)(રહે,અરવિંદ એસ્ટેટ સ્ટાર હોસ્પિટલ ની બાજુમાં બાપુનગર) તા.૦૮/૧૨/૧૭ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર અરવિંદ એસ્ટેટ માં સીડી ઉપર થી પડી જતાં, માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૦૮/૧૨/૧૭ રાતનાં ૧૦/૦૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિલીપકુમાર વસંતલાલ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૪૮૯/૧૭

નિકોલ : નિતિધન નાગજીભાઈ ભુવા (ઉ.વ.૩૪)(રહે,ડી-માર્ટ ની પાસે, નિકોલ) એ કોઈ અગમ્ય કારણસર તા.૧૦/૧૨/૧૭ ના રોજ પોતાના ઘરે અનાજમાં મુકવાની ગોળીઓ (ટીકડીઓ) ખાઈ લેતાં, સારવાર અર્થે તેમને સરદાર હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૦/૧૨/૧૭ બપોરનાં ૩/૪૫ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રામસિંહ ચેહરસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.